



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૮/૧૨/૨૦૧૮ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૩૮૭/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૪ કેસ કરી, ૪૧ વ્યક્તિઓને ઝડપી, ૨૫૦ લીટર દેશી દારૂ અને ૩ બોટલ ઈંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૧ કેસ કરી ૭ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૭,૪૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૩૮૮/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૨૩૮૯/૧૮

સરદારનગર: રીતાબહેન વા/ઓફ કનૈયાલાલ વિશ્વકર્મા (રહે. સંજયનગર ઓજોન સીટી પાછળ આઇ.ટી.આઇ રોડ નોબલનગર) એ તા.૮/૧૨/૧૮ નારોજ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૭/૧૨/૧૮ રાતના ૧૦/૦૦ થી તા.૮/૧૨/૧૮ કલાક ૬/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના ધાબા ઉપરથી મકાનમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપિયા ૫૦,૦૦૦/- અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧,૫૮,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી આર.એન.વીરાણી ચલાવે છે.

ઓઢવ: નયનકુમાર કૌશિકભાઈ મારવાડી (રહે.નવી વસાહત પુનિત કોસીંગ જશોદાનગર) એ તા.૮/૧૨/૧૮ નારોજ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૩/૧૨/૧૮ સાજના ૫/૦૦ થી તા.૦૭/૧૨/૧૮ કલાક ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન ઓઢવ આદિનાથનગર ખાતે આવેલ મણીલક્ષ્મી સોસાયટી દુકાન નંબર-૭૭૬ એમ.કે.સાઉન્ડ નામની સાઉન્ડ સીસ્ટમની દુકાનમાંથી ડુપ્લીકેટ ચાવીથી દુકાનનું તાળુ ખોલી અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી પાંચ એમ્પ્લીફાયર કિમત રૂપિયા ૩૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.જે.ચૌહાણ ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૨૩૯૦/૧૮

સોલા હાઈકોર્ટ: અમીત રમેશભાઈ પટેલ (રહે. શાયોના આગમન શાયોના તીલકની સામે ગોતા) એ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૦૮/૧૨/૧૮ રાતના ૮/૦૦ થી ૯/૪૫ વાગ્યા દરમ્યાન સાયન્સ સીટી રોડ પર મંગલદીપ પાર્ટી પ્લોટ નજીક પાર્ક કરેલ પોતાની ગાડીના દરવાજાનો કાચ તોડી કારમાંથી અજાણી વ્યક્તિ પર્સની ચોરી કરી લઈ હતી. પર્સમાં સોનાના દાગીના અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૮૨,૦૦૦/- મત્તા હતી. આ ગુનાની તપાસ હે.કો.શ્રી હસમુખભાઈ લક્ષ્મણભાઈ ચલાવે છે.

કૃષ્ણનગર: પ્રકાશભાઈ દેવીદાસ ક્રિપલાણી (રહે. મહાસુખનગર કૃષ્ણનગર પાછળ નોબલ સ્કુલની બાજુમાં નરોડા) એ તા.૮/૧૨/૧૮ નારોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે પ્રકાશભાઈ ક્રિપલાણીની કૃષ્ણનગર સરદાર ચોક મહાદેવ મંદિર પાસે કોર મોબાઇલની નામની દુકાન ખાતે છેલ્લા દોઢ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા મનોજભાઈ અશોકભાઈ ચેતવાણી (રહે. મધુવન ઝોરી શ્રીરામ ચોક નવા નરોડા) તા.૧૩/૧૧/૧૮ સવારના ૧૧/૦૦ થી ૧૪/૩૦ વાગ્યા દરમિયાન દુકાનમાંથી વીવો-વી-૧૧ પ્રોગોલ્ડ કંપનીના મોબાઇલ નંગ-૪ કિમત રૂપિયા ૧,૦૩,૯૬૦/- વેચાણ કરી તેમજ રોકડ રૂપિયા ૧,૪૨,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૪૫,૯૬૦/- મતાની ચોરી કરી લઈ નાસી ગયો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.જી.વહોનીયા ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૨૩૯૧/૧૮

ગાયકવાડ હવેલી: લક્ષ્મીબહેન વા/ઓ પ્રવિણભાઈ સોલંકી (ઉ.વ.૪૮) (રહે. રામકૃષ્ણ એપાર્ટમેન્ટ રૂદ્રપ્રયાગની પાછળ રાણીપ) તા.૦૮/૧૨/૧૮ સાજના ૭/૩૦ વાગ્યાના સુમારે જમાલપુર વૈશ્યસભા ત્રણ રસ્તા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક એક્ટીવા ઉપર આવેલ બે પુરુષ લક્ષ્મીબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિમત રૂપિયા ૪૦,૦૦૦/-ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ લક્ષ્મીબહેન સોલંકીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એન.પ્રજાપતિ ચલાવે છે.

લુટની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૨૩૯૨/૧૮

વેજલપુર: વિજયભાઈ દુર્ગારામ કડવાસારા (ઉ.વ.૧૮) (રહે.અગાત્રાઈ દીવ્યા કોર્પોરેશન તા-કેશોદ જી-જુનાગઢ) તા.૦૭/૧૨/૧૮ રાતના ૯/૩૦ વાગ્યાના સુમારે શટલ ઓટોરિક્ષામાં બેસી પસાર થઈ રહ્યા હતા ત્યારે રિક્ષામાં બેઠેલ બે પુરુષોએ રિક્ષા ચાલકની મદદગારીથી રિક્ષા જુહાપુરા એ.પી.એમ.સી.માર્કેટ પાછળ ખુલ્લા મેદાનમાં લઈ જઈ બે પુરુષોએ ઝપાઝપી કરી પાકીટમાંથી રોકડ રૂપિયા ૪૦૦૦/- કાઢી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ વિજયભાઈ કડવાસારાએ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.ડી.રોહિત ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.